


ઉદાસી રોગ (ડિપ્રેશન)

DEPRESSION



ડૉ. નિશાંત અ. સેની

એમ. ડી. (સાઈક્યાટ્રી) - મનોચિકિત્સક

માનસિક, મગજ, વસનમુક્તિ અને મનોઆત્મય રોગોના નિષ્ણાત
સાનિધ્ય માનસિક અને મગજના રોગોની હોસ્પિટલ, પાલનપુર,
સાનિધ્ય સાઇકોથેરેપી એન્ડ કાઉન્સેલિંગ સેન્ટર, પાલનપુર.

- ➡ ઉદાસી રોગ હતારા, નિરાશા કે ડિપ્રેશન જેવા વિવિધ નામે ઓળખાય છે.
- ➡ ઉદાસીરોગ એ મેલી શક્તિઓ, વળગાડ કે પ્રકોપથી થતો રોગ નથી.
- ➡ ઉદાસી રોગ નાટકીય બીમારી કે ટોંગ નથી.
- ➡ હૃદયરોગ કે ડાયાબીટીસની જેમ ઉદાસી રોગ એક બીમારી છે અને તેને અટકાવવા મનોચિકિત્સકની સારવાર જરૂરી છે.
- ➡ ઉદાસી રોગ એ માનસિક બીમારી છે જે મગજનાં વિવિધ ન્યુરોટ્રાન્સમિટર્સ રસાયણોની ઉષાપ કે ઘટાડાથી થાય છે.
- ➡ ઉદાસી રોગ કોઇ પણ સમયે અને વ્યક્તિનું જીવન સારી રીતે ચાલતું હોય તેને પણ થઈ શકે છે.
- ➡ વ્યક્તિને કચા પ્રકારનો ઉદાસી રોગ છે તે મનોચિકિત્સક જ નક્કી કરી શકે છે. વ્યક્તિએ જાતે નક્કી કરવું જોઈએ નહિં.
- ➡ વ્યક્તિને કમજોરી કે કાયરતાની ટીકા કે મેણા ટોણા માર્ગ વગાર તેની યોગ્ય સારવાર કરાવો તેને મદદરૂપ થાઓ.
- ➡ ઉદાસી રોગની સમયસર યોગ્ય સારવાર કરાવવામાં ન આવે તો તે જીવલેણ નીવડી શકે છે.
- ➡ નિષ્ણાતોના અલિપ્રાય પ્રમાણે 70% આત્મહત્યાની ઘટનાઓ ઉદાસી રોગની સમયસર યોગ્ય સારવાર ન કરાવાથી થતી હોય છે.
- ➡ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન (W.H.O) ના જણાવ્યા મુજબ ઉદાસી રોગ દુનિયામાં અશક્તતા માટે ચોથા કમે છે અને 2020 સુધીમાં બીજા કમે આવવાની શક્યતાઓ વધી રહી છે.
- ➡ આ પુસ્તક દ્વારા ઉદાસીરોગ વિધેની સરળ અને સચોટ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.
- ➡ ઉદાસીરોગને સમજુએ અને તેની યોગ્ય સારવાર કરાવવાનો પ્રયાસ આજ્યી જ કરીએ તેવા ઉદ્દેશથી આ પુસ્તક સમાજને સમર્પિત.

ડૉ. નિશાંત એ. સેની
એમ.ડી. સાઇક્યાટ્રી

→ ઉદાસી રોગ (ડિપ્રેશન) :-

૧. ઉદાસી રોગ એટલે શુ ?

- ⇒ આનંદ અને ઉદાસી જીવન સાથે જોડાયેલા છે. અપ્રિય બનાવ બનતાં આપણે ઉદાસ થઈ જઇએ છીએ. આવી ઉદાસી સ્વાભાવિક છે. સંજોગો બદલાતા અને સમય જતાં આવેલી ઉદાસી દુર થઈ જાય છે.
- ⇒ પરંતુ જે ઉદાસી કારણ વગાર થયેલ હોય, કારણાં પ્રમાણમાં લાંબો સમય ચાલે, ઉદાસીને લીધે કામકાજ, સામાજિક સંબંધો અને રોજિંદી પ્રવૃત્તિઓ ઉપર વિપરીત અસર થાય તો તે અસામાન્ય કહેવાય. આવી ઉદાસી ડિપ્રેશન (ઉદાસી રોગ)નું મુખ્ય લક્ષણ હોઇ શકે.
- ⇒ વ્યક્તિની પોતાની મનની નિરાશા, હતાશાની લાગણી તથા નકારાત્મક વિચારો અમુક સમયથી વધારે ચાલે તેને ડિપ્રેશન છે એમ કહેવાય.
- ⇒ હતાશાની લાગણીને કારણે વ્યક્તિના વિચાર અને વર્તન બદલાય છે.
- ⇒ ઉદાસી રોગના લક્ષણો સતત બે અઠવાડિયાં કે તેથી વધારે સમય ચાલુ રહે તો ઉદાસી રોગનું નિદાન કરી શકાય.
- ⇒ ઉદાસી રોગ જેટલો ગંભીર એટલી રોજિંદા જીવન પર એની વધારે અસર થાય.
- ⇒ ઉદાસી રોગનો એક જ હુમલો ઘણાં દર્દીઓને જોવા મળે છે.
- ⇒ મોટાભાગના દર્દીઓને ઉદાસી રોગનો હુમલો વારંવાર થઈ શકે છે.
- ⇒ પંદર થી વીસ ટકા દર્દીઓમાં આ રોગ લાંબા ગાળાનો બની જાય છે.
- ⇒ લગભગ અડધા દર્દીઓને સાજા થયા બાદ પાંચ વર્ષમાં “બીજા હુમલા” આવી શકે છે.
- ⇒ સફળ સારવારથી જ મોટાભાગના દર્દીઓ સંપૂર્ણ સાજ થઈ જાય છે.

૨. ઉદાસી રોગના પ્રકારો કયા કયા છે.

- ⇒ ઉદાસી રોગના લક્ષણો સતત બે અઠવાડિયાં કે તેથી વધુ સમય માટે રહે તો ઉદાસીરોગનું નિદાન કરી શકાય છે.
- ⇒ ફક્ત જાણકારી માટે વિવિધ પ્રકારના ઉદાસી રોગનો પરિચય અહિ આપેલ છે.
- ⇒ વ્યક્તિને કયા પ્રકારનો ઉદાસી રોગ છે તે મનોચિકિત્સક જ નક્કી કરી શકે છે. વ્યક્તિએ જાતે નક્કી કરતું જોઈએ નહિં.
- ⇒ મનોચિકિત્સક પૈશાનિક પદ્ધતિ મુજબ આઇ.સી.ડી કે ડી.ઓસ.એમ.માં આપેલ ઉદાસી રોગના વિવિધ વર્ગીકરણ ઉપરથી તેનો પ્રકાર નક્કી કરતા હોય છે.

● મેજર ડિપ્રેશિવ ડિસઓર્ડર (MAJOR DEPRESSIVE DISORDER) :-

- ⇒ ઉદાસી રોગના લક્ષણો સતત બે અઠવાડિયા કે વધુ સમય માટે જોવા મળે તો તેને મેજર ડિપ્રેશિવ ડિસઓર્ડર કહેવાય છે.

● બાયપોલર ડિપ્રેશન (BIPOLAR DEPRESSION) :-

- ⇒ બાયપોલર મુડ ડિસઓર્ડરમાં ઉન્માદના પ્રથમ હુમલા પછી ઉન્માદ અને ઉદાસી રોગના હુમલા આવતા હોય છે.
- ⇒ આ રોગમાં જ્યારે ઉદાસી રોગના લક્ષણોનો હુમલો આવે ત્યારે તેને બાયપોલર ડિપ્રેશન કહે છે.

● સિઝનલ અફેક્ટિવ ડિપ્રેશન (SEASONAL AFFECTIVE DISORDER) :-

- ⇒ ઉદાસી રોગના લક્ષણોની શરૂઆત વર્ષમાં કોઇ ખાસ મહિના કે સમયમાં સતત બે વર્ષ કે વધુ વર્ષોમાં જોવા મળે તો તેને સિઝનલ અફેક્ટિવ ડિપ્રેશન કહે છે.
- ⇒ કેટલાક વ્યક્તિઓમાં ઉદાસી રોગ અમુક મહિનામાં શરૂ થતો હોય છે જેમકે ગરમી કે ઢંડીની શરૂઆત.

- **ડિસ્થાયમિક ડિપ્રેશન (DYSTHAMIA) :-**
 - ⇒ ઉદાસી રોગના લક્ષણો સતત વધ્યા વગાર એકધારા જે વર્ષ સુધી રહે તો તેને ડિસ્થાયમિક ડિપ્રેશન કહેવાય છે.

- **ઓટિપિકલ ડિપ્રેશન (ATYPICAL DEPRESSION) :-**
 - ⇒ આ પ્રકારમાં નીચેના વિરોધાભાસી લક્ષણો વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેમકે ;
 - વધારે ઊંઘ આવવી,
 - વધારે ભુખ લાગવી કે વજન વધવું,
 - લાંબા સમય માટે અન્ય કે પોતાના માટેની આંતરિક લાગણીની ઉપેક્ષા અનુભવવી,
 - હાથ પગમાં જડતા કે ભાર અનુભવવો,
 - ચિંતા રોગના કે ફડકીના લક્ષણો વધુ જોવા મળવા.

- **મિલેન્કોલિક ડિપ્રેશન (MELANCHOLIC DEPRESSION) :-**
 - ⇒ આ પ્રકારમાં નીચેના લક્ષણો વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેવા કે
 - વહેલી સવારે ઉદાસીનતાના લક્ષણો વધી જવા,
 - કારણ વગરની કે વધુ પડતી પરસ્તાવાની લાગણી થવી,
 - વહેલી સવારે ઊંઘ ઉડી જવી,
 - ભુખ ઓછી લાગવી કે વજન ઉતરી જવું,
 - ઉત્સાહ ઉમંગ જતા રહેવા (એનહેડોનિઅા),
 - આગસ કે કોઇ વધવો.

- **પોસ્ટપાર્ટમડિપ્રેશન (POSTPARTUM DEPRESSION) :-**
 - ⇒ ઉદાસી રોગના લક્ષણો ડિલિવરી કે પ્રસુતિ પછીના મહિનાઓમાં જોવા મળે તો તેને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કહેવાય છે.

- **પ્રિમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડર (PREMENSTRUAL DYSPHORIC MOOD DISORDER) :-**
 - ⇒ વારંવાર ઉદાસી રોગના લક્ષણો માસિકની શરૂઆતના અઠવાડિયા પહેલાથી જેવા મળે તો તેને પ્રિમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિપ્રેશન કહેવાય છે.

- **સાઇકોટિક ડિપ્રેશન (PSYCHOTIC DEPRESSION) :-**
 - ⇒ ઉદાસી રોગના લક્ષણોની સાથે સાથે વિચારવાચુના લક્ષણો જેવા કે વહેમ, શંકા, ડર, જિક જેવા લક્ષણો જેવા મળે તો તેને સાઇકોટિક ડિપ્રેશન કહેવાય છે.

- **सिचुअेशनल डिप्रेशन** (SITUATIONAL DEPRESSION) :-
 ⇒ ઉદાસી રોગના લક્ષણો જુવનમાં કેટલીક ઘટનાઓ જેમકે છુટાછેડા,
 નોકરી જતી રહેવી, નિવૃત થવુ કે નજીકના સ્વજન કે મિત્રનું આકસ્મીક
 મૃત્યુ થવાથી જોવા મળે તો, તેને સિચુઅએશનલ ડિપ્રેશન કહેવાય છે.

- **સેકન્ડરી ડિપ્રેશન** (SECONDARY DEPRESSION) :-
 ⇒ ઉદાસી રોગના લક્ષણો અન્ય મેડિકલ, સર્જુકલ બીમારી, વ્યસનના
 બંધાણ પછી થાય તો તેને સેકન્ડરી ડિપ્રેશન કહેવાય છે.

- **માઇનોર ડિપ્રેશન** (MINOR DEPRESSIVE DISORDER) :-
 ⇒ ઉદાસી રોગના લક્ષણો ઓછા પ્રમાણ કે માત્રામાં બે અઠવાડિયા કે તેથી
 વધુ સમય માટે જોવા મળે તો તેને માઇનોર ડિપ્રેશન કહેવાય છે.

- **રિકરન્ટ બ્રિફ ડિપ્રેશન** (RECURRENT BRIEF DEPRESSION) :-
 ⇒ ઉદાસી રોગના લક્ષણો બે દિવસથી બે અઠવાડિયા સુધી મહિનામાં એક
 વાર એક વર્ષ સુધી જોવા મળે તો તેને રિકરન્ટ બ્રિફ ડિપ્રેશન કહેવાય છે.

- **કોનિક ડિપ્રેશન** (CHRONIC DEPRESSION) :-
 ⇒ ઉદાસી રોગના લક્ષણો સતત બે વર્ષ કે તેથી વધુ સમય સુધી રહે તો તેને
 કોનિક ડિપ્રેશન કહેવાય છે.

- **રેજિસ્ટરન્ટ કે રિફેક્ટરી ડિપ્રેશન** (RESISTANT OR REFRACTORY
 DEPRESSION) :-
 ⇒ બે અલગ અલગ વિભાગની એન્ટિ ડિપ્રેશનની દવાઓ પુરતા પ્રમાણમાં
 અને પુરતા સમય સુધી આપવા છતા પણ ઉદાસી રોગના લક્ષણો પુર્ણ
 રીતે કાબુમાં ન આવે અને રોગ મટે નહિ તેને રેજિસ્ટરન્ટ કે રિફેક્ટરી
 ડિપ્રેશન કહેવાય છે.

 ⇒ આ ઉપરાંત ડબલ ડિપ્રેશન, પોસ્ટ સાઇકોટિક ડિપ્રેશન, એન્ડોજુનસ
 ડિપ્રેશન, એક્સોજુનસ ડિપ્રેશન કે રિએક્ટિવ ડિપ્રેશન જેવા વિવિધ પ્રકાર
 જોવા મળતા હોય છે.

3. ઉદાસી રોગ કોને અને કેટલી ઉંમરે થાય ?

- ⇒ કોઇ પણ વ્યક્તિને, કોઇ પણ ઉંમરે, કોઇ પણ જાતિ કે જ્ઞાતિમાં, કોઇ પણ જાતની રહેણીકરણી ધરાવનારને ઉદાસી રોગ થએ શકે છે.
- ⇒ સામાન્ય રીતે ઉદાસી રોગનો પહેલો હુમલો ૨૦ થી ૩૦ વર્ષની ઉંમરના ગાળામાં આવતો હોય છે.
- ⇒ પુરુષ કરતાં સ્ત્રીઓમાં પ્રમાણ વધુ હોય છે.
- ⇒ સ્ત્રીઓમાં ગર્ભધારણ કરવાની ઉંમર એટલે કે ૨૫ થી ૪૦ દરમ્યાન વધુ શક્યતા છે.
- ⇒ જો કુટુંબમાં કોઇ વ્યક્તિને ઉદાસી રોગ હોય તો તેના કુટુંબીજનોને ઉદાસી રોગ થવાની વધુ શક્યતા છે.
- ⇒ સામાન્ય રીતે કોઇ પણ ડોક્ટરને જતાવવા જતા કુલ દર્દીઓમાંથી ૨૦ થી ૨૫ ટકા દર્દીઓમાં ઉદાસી રોગના લક્ષણો જેવા મળે છે.
- ⇒ અત્યારે ચુવાનોમાં અને વૃદ્ધ સમુદાયમાં ઉદાસી રોગનું પ્રમાણ વધી રહ્યું છે.

૪. ઉદાસી રોગ શાથી થાય ?

● મગજમાં જીવરસાયણોમાં ફેરફાર :

- ⇒ મગજ એકબીજા સાથે જોડાયેલાં લાખો ફાટાતંતુઓનું અસંખ્ય ગુંચળાનું બનેલું હોય છે.
- ⇒ તેમની વચ્ચે ચેતા સંદેશવાહક કે ન્યૂરો ડ્રાન્સમીટર નામે ઓળખાતાં જીવરસાયણોની યોગ્ય કામગીરીથી સંદેશા વાહન થાય છે.
- ⇒ આ રાસાયણિક તત્વોમાંથી અમુક તત્વો જેવા કે સીરોટોટીન અને નોરાએપીનેફીનનું પ્રમાણ ઘટી જવાથી ઉદાસી રોગ થાય છે.

● વારસો :

- ⇒ અમુક કુટુંબોમાં ઉદાસી રોગ ખાસ જેવા મળે છે. કારણ કે ઉદાસી રોગ વારસાગત હોઇ શકે.
- ⇒ ઉદાસી રોગ ધરાવતાં માતા કે પિતાના બધા સંતાનોને અચૂક ઉદાસી રોગ થતો નથી. પરંતુ તેનું જોખમ વધે છે.

● નકારાત્મક બનાવો :

- ⇒ જીવનના વિવિધ તબક્કાઓમાં થતા નકારાત્મક બનાવો જે અણાધાર્ય અને એક પછી એક સતત આવ્યા કરે તો તે ઉદાસી રોગ માટે અગત્યનું પરિબળ બને છે.
- ⇒ આવા નકારાત્મક બનાવોને લીધે વ્યક્તિ લાચારી અનુભવે છે, તેના વિચારો અને લાગણીઓમાં ફેરફાર થાય છે.
- ⇒ નકારાત્મક બનાવો જેવા કે
 - > સ્વજનનું મરણ
 - > નોકરી ગુમાવવી, બીજી નોકરી ન મળવી
 - > પૈસા ટકાની મુશ્કેલી
 - > કાયમી ખોડ ખાંપણ રહી જાય તેવા અકસ્માત કુદરતી હોનારત, ભુકંપ-પુરના ભોગ થવું કે હિંસા, બળાલકાર કે જાતીય શોષણાના ભોગ થવું.
 - > લાંબા ગાળાની શારીરિક બીમારી
 - > લાંબા ગાળાની બીમારી ઘરાવતા સ્વજનની સંભાળ
 - > લાંબા ગાળાનું સંધર્ષમય જીવન

● શારીરિક રોગો :

- ⇒ અન્ય શારીરિક રોગો ખાસ કરીને અંતઃસ્ત્રાવો અને અન્ય મેડીકલ, સર્જુકલને લગતા રોગોમાં ઉદાસી રોગ લાંબા ગાળે થઇ શકે.
- ⇒ થાઇરોઇડ અને વિટામીન B12 ની ઉણપથી પણ ઉદાસી રોગ થતો હોય છે.

● અન્ય માનસિક રોગ :

- ⇒ ઉન્માદ, ચિંતા રોગ, વિચાર વાયુની સાથે પણ ઉદાસી રોગ થવાની સંભાવના રહેલી છે.

● વ્યસન / બંધાણ :

- ⇒ દારૂ, અફ્ઝીએ, ચરસ, ગાંઝ જેવા માદક દ્રવ્યોનાં વ્યસનો દર્દી તેમજ કુટુંબમાં ઉદાસી રોગ વધારે છે.

● દવાઓ :

- ⇒ રોગોની સારવાર માં આપવામાં આવતી કેટલીક દવાઓ પણ ઉદાસી રોગનું કારણ હોય છે. જેમકે સ્ટીરોઇડની દવાઓ લેવાથી ઉદાસી રોગ થઇ શકે છે.

● વ्यक्तिगत परिभળ :-

- ⇒ ઉદાસીરોગનું જોખમ ખાસ આ વ્યક્તિને વધારે જોવા મળે છે જે
 - > જેઓ વધુ પડતા સંવેદનશીલ હોય
 - > જેમને અગાઉ ઉદાસી રોગ થયેલ હોય
 - > જેમના કુટુંબમાં કોઈને ઉદાસી રોગ હોય
 - > સ્વભાવની અમુક ખામી હોય
 - > જેઓનું બાળપણ મુશ્કેલીભર્યું હતું (શારીરિક માર, જાતીય શોષણા, વધુ પડતી કડક શિસ્તા, ઉપેક્ષા)

પ. ઉદાસી રોગના લક્ષણો કેવા હોય ?

● માનસિક લક્ષણો :-

- ⇒ મનમાં હતાશા કે ઉદાસીનતાનો અનુભવ થવો.
- ⇒ કોઇ પણ કિયાઓમાં આનંદ ન આવવો.
- ⇒ જુવનમાં અગાઉ ગમતી પ્રવૃત્તિઓમાં રસ ન પડવો.
- ⇒ કામ કરવામાં ધ્યાન ન રહેવું, એકાગ્રતા ઘટી જવી.
- ⇒ જુવનમાં નિરાશા લાગવી, ભવિષ્ય ધૂધળું લાગવું.
- ⇒ હું પોતે જ નકામો છું એવી ભાવના થવી.
- ⇒ નકારાત્મક વિચારો આવવા.
- ⇒ પોતાને ઉદાસી રોગ છે તેનાથી નાનમ અનુભવવી.
- ⇒ ચાદશક્તિ ઘટી ગાંઢ છે તેમ લાગવું.
- ⇒ જુવન એકલવાચું લાગવું.
- ⇒ જુવન વ્યર્થ છે, જુવનમાં કોઇ રસ નથી એવું લાગવું.
- ⇒ મારા વિચારો કે બિમારી માટે હું જ જવાબદાર છું તેમ વિચારવું.
- ⇒ ભગવાન લદ લે તો સારું તેમ વિચારવું.
- ⇒ આત્મહત્યાના વિચારો આવવા તથા પ્રયત્ન કરવા.

● શારીરિક લક્ષણો :-

- ⇒ ભૂખ ઓછી લાગવી અને વજન ઘટવું, કયારેક ભૂખ વધવી.
- ⇒ ઊંઘ ઓછી આવવી, વધારે સપનાઓ આવવાં, કયારેક ઊંઘ વધવી.
- ⇒ માથાનો દુઃખાવો થવો કે મગજમાં બળતરા થવી.
- ⇒ શરીરના જુદા જુદા ભાગોમાં દુઃખાવો થવો.

- ⇒ હાથ પગમાં ખેંચાણ થવું કે ખાલી ચટવી.
- ⇒ પેટમાં ગરબડ થવી કે કબજુયાત રહેવી.
- ⇒ શારીરિક થાક અને અશક્તિ લાગવી.
- ⇒ શારીરિક સમાગમમાં ઉચેજના ઓછી થવી.
- ⇒ સ્ત્રીઓમાં માસિક અંગોની તકલીફો.

● સામાજિક લક્ષણો :-

- ⇒ વ્યસનો વધી જવાં કે ચાલુ કરવા.
- ⇒ નોકરી-દંધા કે ઘરકામમાં અનિયભિતતા આવવી.
- ⇒ નજુકના સગા-સંબંધીઓ સાથેના સામાજિક વ્યવહાર ઓછા થવા.

● વર્તનમાં ફેરફાર :-

- ⇒ સ્વભાવ ચિંદિયો થઇ જવો.
- ⇒ એકલા ગુમસૂમ બેસી રહેવું.
- ⇒ કુદુંબની વ્યક્તિઓ કે મિત્રોથી દૂર રહેવું.
- ⇒ નાની નાની બાબતોમાં રડવું આવવું.
- ⇒ સ્વચ્છ સુધાડ કપડાં કે શુંગારનો લગાવ ન રહેવો.
- ⇒ શારીરિક સ્વચ્છતા કે નહાવા ધોવા પ્રત્યે બેદરકારી સેવવી.
- ⇒ કોઇ પણ પ્રવૃત્તિમાં રસ ન રહેવો.

૬. બાળકોમાં ઉદાસી રોગના લક્ષણો કયા કયા હોય છે. ?

- ⇒ એકલવાચું રહેવું, કોઇની સાથે હળવું મળવું નહિં.
- ⇒ મિત્રો કે કુદુંબની વ્યક્તિઓથી દૂર રહેવું.
- ⇒ શાળાએ ભણતરમાં પાછા પડવું કે પરીક્ષા પહેલા ડર લાગવો.
- ⇒ પોતાને ગમતી પ્રવૃત્તિઓ માંથી રસ ઉડી જવો.
- ⇒ વારંવાર નાની નાની બાબતોમાં ગુર્ઝો આવવો કે ધમપણાડા કરવા.
- ⇒ વારંવાર માથું દુખવું કે શારીરિક દુખાવા થવાની ફરીયાદ કરવી.
- ⇒ શારીરિક સ્વચ્છતા કે નહાવા ધોવા પ્રત્યે બેદરકારી સેવવી.
- ⇒ આળસ વધી જવી.
- ⇒ ઊંઘમાં અનિયભિતતા થવી.
- ⇒ નાની નાની બાબતોમાં રડવું આવવું.
- ⇒ બાળકોમાં શારીરિક અને વર્તનને લગતા લક્ષણો વધુ જોવા મળે છે.

૭. વૃદ્ધાવસ્થામાં ઉદાસી રોગના લક્ષણો કર્યા કર્યા હોય છે.

- ⇒ પોતાને ગમતી પ્રવૃત્તિઓ માંથી રસ ઉડી જવો.
- ⇒ ચાદશક્તિમાં ફેરફાર થવો.
- ⇒ વારંવાર નાની નાની બાબતોમાં ગુસ્સો આવવો.
- ⇒ વારંવાર માથું દુખવું કે શારીરિક દુખાવા થવાની ફરીયાદ કરવી.
- ⇒ શારીરિક સ્વચ્છતા કે નહાવા કે ધોવા પ્રત્યે બેદરકારી સેવવી.
- ⇒ ઊંઘમાં અનિયભિતતા થવી.
- ⇒ કારણ વગાર રડવું આવવું.
- ⇒ વૃદ્ધાવસ્થામાં લાગણી અને વર્તનને લગતા લક્ષણો વધુ જોવા મળે છે.

૮. ઉદાસી રોગનું મોટામાં મોટું જોખમ કર્યું છે ?

- ⇒ ઉદાસી રોગના દર્દીઓમાં આપદાતનું જોખમ જોવા મળે છે.
- ⇒ આપદાતથી મરણ પામનારાઓમાં ૮૦ ટકાથી વધારે વ્યક્તિઓ ઉદાસી રોગના દર્દીઓ હોય છે.
- ⇒ ઉદાસી રોગના ૧૫ ટકા દર્દીઓ આપદાતથી મૃત્યુ પામે છે.
- ⇒ સામાન્ય માન્યતાથી ઉલદું, મોટા ભાગના આપદાતની કોશિશ કરનાર તથા આપદાતથી મરણ પામનાર પોતાની આપદાત કરવાની દાઢા મિત્રો, ડૉક્ટરો અને કુટુંબીજનો પાસે વ્યક્ત કરતા હોય છે.
- ⇒ જો કોઇ આપદાતની વાત કરે તો તેને ગંભીરતાથી લેવી જોઇએ અને વહેલામાં વહેલી તકે માનસિક રોગોના નિષ્ણાત પાસે નિદાન કરાવી સારવાર આપવી જોઇએ, જેથી આપદાતનું જોખમ ટાળી શકાય.
- ⇒ આપદાતનું જોખમ ઉદાસી રોગના બે તબક્કે વધારે હોય છે. લાચારી, હવાશા વગેરે વધુ હોય તે તબક્કામાં અને સારવાર દરમ્યાન દર્દી ઉદાસીમાંથી બહાર આવતો હોય ત્યારે.

૯. ઉદાસી રોગનું નિદાન કેવી રીતે કરી શકાય ?

- ⇒ ઉદાસી રોગના નિદાન માટે કોઇ લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે કે સીટી સ્કેન-એમ.આર.આધ. ઉપલબ્ધ નથી.
- ⇒ ઉદાસી રોગના કિસ્સામાં આ તપાસો અન્ય શારીરિક રોગોની શક્યતા નિવારવા જરૂરી બને છે.
- ⇒ ઉદાસી રોગનું નિદાન નિષ્ણાત મનોચિકિત્સક, સાઇકોલોજિસ્ટ, દર્દી અને

સગા-સંબંધીઓની વિગત, દર્દીની માનસિક અવસ્થાનું પરિદ્ધાણ, કૌદુર્યિક, સામાજિક, અંગત જીવનના પરિબળો અને પોતાના અનુભવના આધારે જ કરાતું હોય છે.

- ⇒ ઉદાસી રોગના નિદાન માટે વિવિધ ઘેફાનિક પ્રશ્નાવલી રેટિંગ સ્કેલનો ઉપયોગ કરી શકાય છે. એમ.એ.ડી.આર.એસ. (M.A.D.R.S) અને એચ.એ.એમ..ડી. (HAM-D) નો ઉપયોગ ઉદાસી રોગની તીવ્રતા અને લક્ષણો જાણી નિદાન કરી શકાય છે.

૧૦. ઉદાસી રોગની સારવાર શું છે ?

- ⇒ ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવામાં આવે તો ઉદાસી રોગ મટી શકે છે.

● દવાઓ :-

- ⇒ ઉદાસી રોગની સારવારમાં ઘણી જાતની દવા વપરાય છે.
- ⇒ દરેક દર્દી માટે દવાઓ અને તેની માત્રા ઘણાં પરિબળો ઉપર આધાર રાખે છે.
- ⇒ જેમકે :-

- દર્દીની ઉંમર
- દર્દીની જાતિ-સ્ત્રી કે પુલખ
- ડિપ્રેશન સાથે રહેલી અન્ય માનસિક બીમારીનાં લક્ષણો
- સાથે રહેલી શારીરિક બીમારી અને તેની ચાલતી દવાઓ
- દવાઓની અસર અને આડ અસર

- ⇒ દવાઓથી ઉદાસી રોગના લક્ષણોમાં ઝડપી સુધારો આવે છે.
- ⇒ દવાઓથી સામાન્ય રીતે સારુ લાગતાં ૧ થી ૬ અઠવાડિયા લાગે છે. સંપૂર્ણ સારવાર લાંબી ચાલે છે.

● સાયકોથેરેપી :-

- ⇒ ઉદાસી રોગમાં જુદા જુદા પ્રકારની સાયકોથેરેપીનો ઉપયોગ થતો હોય છે. સામાન્ય રીતે વપરાતી સાયકોથેરેપીમાં
- કોગિનાટિવ બિહેવિયર થેરેપી
- સોક્સિયલ સ્ક્રિલ ટ્રેઇનિંગ
- કોપિંગ સ્ક્રિલ ટ્રેઇનિંગ
- એસ્ટિટિવ ટ્રેઇનિંગ
- સ્ટ્રેસ મેનેજમેન્ટ

- ⇒ સાચકોથેરેપીમાં દર્દી સાથે મનોધેઝાનિક ભાષામાં વાતચીત કરી તેના મનનું વિખ્લેખણ કરવામાં આવે છે અને જિનઉપયોગી અને અતાર્કિક વિચારો પારખવામાં અને તે દૂર કરી વાસ્તવિક અને તાર્કિક વિચારો કરવા પ્રેરે છે.
- ⇒ દવાની સાથે સાથે યોગ, ધ્યાન, મેડીટેશન, ડીપ બ્રિથિંગ અને સુર્ય નમર્સ્કારનો ઉપયોગ કરી હકારાત્મક અભિગમ કેળવી શકાય છે અને લાંબા સમય સુધી નિરોગી રહી શકાય છે.
- દવાઓ અને સાચકોથેરેપી :-
- ⇒ દવાઓ અને સાચકોથેરેપીનો યોગ્ય સમજવય ઉદાસી રોગમાં વધુ સારુ પરિણામ આપે છે.
- ધ.સી.ટી. (વીજળીક શેક સારવાર) :-
- ⇒ ધ.સી.ટી. થી ખૂબ સારું પરિણામ ઝડપથી મેળવી શકાય છે.
- ⇒ સામાન્ય રીતે આ સારવારનો ઉપયોગ :-

 - જો દર્દીને આત્મહત્યાના ખૂબ વિચારો આવતા હોય.
 - જો દર્દી સાવ સૂનમૂળ થદ ગયો હોય.
 - જો દર્દીમાં જોઇએ તેટલો સુધારો દવાઓથી ન આવે.
 - જો દર્દીને અમુક ખાસ પ્રકારનો ઉદાસી રોગ હોય, વગેરે સંજોગોમાં કરવામાં આવે છે.

- ⇒ આ ઉપરાંત વેગસ નર્વ સ્ટીમ્યુલેશન, સ્લીપ ડેપ્રાઇવેશન, ફોટો થેરેપી (લાઇટ થેરેપી) અને આર.ટી.એમ.એસ.નો પણ ઉપયોગ થાય છે.

૧૧. ઉદાસી રોગ મટી શકે છે. ?

- ⇒ ઉદાસી રોગ મટી શકે છે.
- ⇒ યોગ્ય સમયે નિદાન અને સારવાર કરવામાં આવે તો ઉદાસી રોગ ઝડપથી મટી શકે છે.
- ⇒ ઉદાસી રોગની સારવાર નિયમીત અને ડૉક્ટરની સલાહ મુજબ લેવામાં આવે તો આ રોગનું મટવું બહુ ઝડપી થદ શકે.
- ⇒ કેટલાક વ્યક્તિઓમાં ઉદાસી રોગના હુમલા વારંવાર આવતા હોય છે, આવા સંજોગોમાં લાલાં ગાળાની સારવાર હિતાવહ છે.
- ⇒ ઉદાસી રોગમાંથી સારા થવાનો આધાર સૌથી વધારે દર્દી કચારે મનો-ચિકિત્સકની સલાહ સારવાર લે છે તેના ઉપર રહેલો છે.

- ૧૨. ઉદાસી રોગમાં દવાઓ કયાં સુધી ચાલુ રાખવી ?**
- ⇒ ઉદાસી રોગની દવાઓ દર્દીના રોગની તીવ્રતા, લક્ષણો, ઉંમર, દર્દીના રોગમાં થતો સુધારો, આડ અસરો અને રોગ થવાની સમય મર્યાદા જેવા ઘણા બધા પરિભળો ઉપર આધાર રાખે છે.
 - ⇒ ઉદાસી રોગની દવાની અસરની શરૂઆત લગભગ અઠવાડીયાથી પંદર દિવસે થાય છે. ચાર થી છ અઠવાડીએ દવાની સંપૂર્ણ અસર થાય છે. અપવાદરૂપ કિર્સામાં ફેરફાર થઈ શકે.
 - ⇒ ઉદાસી રોગમાં એકદમ સારું થઈ ગયા પછી પણ લાંબા સમય સુધી દવાઓ ચાલુ રાખવી ખૂબ જ જરૂરી છે. જેથી ફરીથી રોગનો ઉથળો મારવાની શક્યતા ઓછી રહે છે.
 - ⇒ ઉદાસી રોગમાં સામાન્ય રીતે ૬ થી ૧૨ મહિના દવાઓ ચાલુ રાખવી પડે છે, છતાં કોઇ દર્દીમાં દવાઓ લાંબો સમય કે આજુવન પણ લેવી હિતાપહ છે.
 - ⇒ કચારેય પણ જાતે દવાઓ લેવી નહીં, વધઘટ કરવી નહીં કે બદલવી જોઈએ નહીં.
 - ⇒ બીમારીના લક્ષણો દુર થતાં કે મટી જતા તરત જ દવા જાતે જ બંધ કરવી કે ઓછી કરવી નહિં.
 - ⇒ હંમેશા દવાઓ માટે મનોચિકિત્સકની સલાહ લેતાં રહેવું જોઈએ.
- ૧૩. ઉદાસી રોગના દર્દી ગર્ભધારણ કરી શકે અને બાળકને ધાવણ આપી શકે ?**
- ⇒ ઉદાસી રોગના દર્દી ગર્ભધારણ કરી શકે છે અને બાળકને ધાવણ આપી શકે છે.
 - ⇒ ગર્ભધારણ પહેલા મનોચિકિત્સકને મળો જેથી આવનાર બાળકને નુકશાન ન થાય તે માટે દવામાં ફેરફાર કરી શકાય.
 - ⇒ ઉદાસી રોગની અમુક પ્રકારની દવાઓ ગર્ભધારણ વખતે અને ધાવણ વખતે લઈ શકાય છે. માટે જ તમારા મનોચિકિત્સકને મળી યોગ્ય સલાહ સૂચન લેવાનું ભૂલશો નહિં.
 - ⇒ એકદમ દવા બંધ કરવાથી ગલ્બવિસ્થા દરમિયાન ઉદાસી રોગના લક્ષણો ગંભીર રીતે વધી શકે છે.

⇒ ગર્ભધારણ પહેલા જ તમારા મનોચિકિત્સક જોકે યોગ્ય સલાહ સૂચન લઇ દવાઓમાં ફેરફાર કરાવો.

૧૪. ઉદાસી રોગની દવાઓ સાથે અન્ય બીમારીની દવાઓ લઇ શકાય ?

- ⇒ ઉદાસી રોગના દર્દીએ કોઈ મેડિકલ કે સર્જુકલ બીમારી થાય તો તેની દવા લેતી વખતે ઉદાસી રોગની દવાઓ બંધ કરવી નહિં કે વધાર કરવી નહિં.
- ⇒ ઉદાસી રોગની દવાઓ અન્ય બીમારી સાથે લઇ શકાય છે.
- ⇒ અન્ય ડૉક્ટરને બતાવવાનું થાય ત્યારે તમારી ઉદાસી રોગની દવાઓ બતાવી દેવી.
- ⇒ અન્ય ઓપરેશન કે મેડિકલ તપાસ કરાવતા પહેલા તમારા ઉદાસી રોગના મનોચિકિત્સકની સલાહ લેવાનું ચુકશો નહિં.

૧૫. ઉદાસી રોગની સારવારમાં કુટુંબીજનો અને ભિત્રોનો શું કાળો હોઇ શકે ?

- ⇒ કુટુંબીજનો અને ભિત્રો યોગ્ય ટેકો આપે તો ઉદાસી રોગ વહેલો મટી શકે છે.
- ⇒ ઉદાસી રોગ ધરાવતી વ્યક્તિને ટીકા કાર્ય વગાર, ઉતારી પાડ્યા સિવાય સહાનુભૂતિપૂર્વક સાંભળવા.
- ⇒ ‘આળસું થઈ ગયા છો.’, ‘કામ કરતા જોર આવે છે’, ‘તમે નબળા છો’, ‘બહુ ના વિચારો’, ‘હાથે કરીને હેરાન થાઓ છો.’ જેવી ટિપ્પણી ન કરો.
- ⇒ દર્દી દવાઓ નિયમિત લે તે ધ્યાન રાખો.
- ⇒ ડૉક્ટરને નિયમિત બતાવો.
- ⇒ ધીરજ રાખો અને દર્દીને કોઈ પણ કાર્ય માટે પ્રોત્સાહિત કરો.
- ⇒ આત્મહંત્યાનાં સંકેતો જણાય તો તાત્કાલિક ડૉક્ટરને સંપર્ક કરો.

૧૬. ઉદાસી રોગમાં વધુ સારી રીતે જીવન જીવવા દર્દીએ શું કરવું જોઈએ ?

- ⇒ જીવનને નિયમિત બનાવો.
- ⇒ હકારાત્મક વલણ રાખો.
- ⇒ એકલા રહેવાનું ટાળો.

- ⇒ તમારા કાર્યમાં કોઇની મદદ જોઈતી હોય તો કહો.
 - ⇒ જુવનના સંઘર્ષનો હકારાત્મક રીતે સામનો કરો અને તેમાંથી કંઈક નવું શીખવા મળશે તેમ વિચારો.
 - ⇒ ગુરુસા ઉપર કાબુ રાખો.
 - ⇒ મિત્રો, સગા-સંબંધોઓને મળવાનું રાખો.
 - ⇒ દવાઓ નિયમીત લેવી જોઈએ.
 - ⇒ નકારાત્મક વિચારો માટે ચોગ્ય સમયે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ.
- ૧૭. ઉદાસી રોગ માટે દર્દીએ પોતે શું કરવું ?**
- ⇒ ઉદાસી રોગ માટે દર્દીએ મનોચિકિત્સકની સલાહ લેતા અચકાવું ન જોઈએ.
 - ⇒ દર્દીએ ખુલ્લા મને બધી જ વાત ડૉક્ટરને કરવી જોઈએ.
 - ⇒ દર્દીએ મનમાં રહેલા હકારાત્મક કે નકારાત્મક ભાવ ડૉક્ટરને કહેવા જોઈએ.
 - ⇒ દર્દીએ દવાઓ નિયમીત લેવી જોઈએ.
 - ⇒ સારવાર દરમિયાન પોતાને અનુભવાતા નકારાત્મક વિચારો માટે ખુલ્લા મને બધી જ વાત ડૉક્ટરને કરવી જોઈએ.
 - ⇒ દર્દીએ ગુરુસો, નિરાશા, હતાશા, ચિંતા કે પસ્તાવાને કાબુમાં રાખતા શીખવું જોઈએ.
 - ⇒ નવરા બેસી રહેવા કરતા કોઇ કામ શોધી લેવું જોઈએ.
 - ⇒ ઉદાસી રોગની વ્યક્તિએ એકલા ન રહેતા પોતાના કુટુંબીજનો અને સારા મિત્રોની સાથે રહેવું જોઈએ.
 - ⇒ ખોટા અને નકામા વિચારોને મનમાંથી દુર કરો, આગળ ભવિષ્યમાં જુઓ, ભુતકાળને વારંવાર યાદ કરી પસ્તાવાનું બંધ કરો અને હકારાત્મક જીવન જુવો.
- ૧૮. ઉદાસી રોગ માટે ફેમીલી ડૉક્ટરે શું કરવું ?**
- ⇒ આપના દેશમાં કોઇ પણ જિમારી માટે દર્દી સૌથી પહેલા પોતાના ફેમીલી ડૉક્ટર પાસે જતો હોય છે.
 - ⇒ ફેમીલી ડૉક્ટર જે ઉદાસી રોગ માટેના લક્ષણોની જાણકારી ધરાવતો હોય તો ચોગ્ય રીતે સહાય કરી શકે.
 - ⇒ ફેમીલી ડૉક્ટર એ દર્દી અને મનોચિકિત્સકને જોડતી અગત્યની કડી છે.

- ⇒ ફેમીલી ડૉક્ટર દર્દીને મનોચિકિત્સકની સારવાર લેવા પ્રોત્સાહિત કરી શકે છે અને સારવાર નિયમીત લેવા માટે મદદરૂપ થએ શકે છે.
- ⇒ ફેમીલી ડૉક્ટર દર્દી અને કુટુંબીજનોના ઉદાસી રોગ વિધેની ગેરસમજ, અંધશ્રદ્ધા અને ડર દુર કરાવી વહેલી તકે સમયસર સારવાર માટે સમજાવી શકે છે.

૧૯. ઉદાસીરોગ માટે સામાજુક કાર્યકરે શું કરવું ?

- ⇒ ઉદાસી રોગ માટે સામાજુક કાર્યકર પાસે રોગના લક્ષણોનું પ્રાથમિક ઝાણ હોવુ જરૂરી છે.
- ⇒ સામાજુક કાર્યકરે પોતાના કાર્યક્રમાં ઉદાસી રોગની વ્યક્તિત્વ ચોગ્ય સલાહ, સૂચન, માર્ગદર્શન આપી સારવાર માટે પ્રોત્સાહિત કરવો જોઈએ.
- ⇒ સામાજુક કાર્યકરે વ્યક્તિત્વ મનોચિકિત્સકની સલાહ માટે પ્રોત્સાહિત કરવો જોઈએ.
- ⇒ સામાજુક કાર્યકરે વારે તહેવારે પોતાના કાર્યક્રમાં ઉદાસી રોગોની જાગૃતિ માટેના કાર્યક્રમો ચોજવા જોઈએ.

૨૦. ઉદાસી રોગ વિધેની ખોટી માન્યતાઓ :-

(૧) ઉદાસી રોગ વાસ્તવમાં બીમારી નથી :-

- ⇒ મગજ શારીરનું અએવું અવયવ છે જે હૃદય, ફેફસા, ચક્કૂત કે કિડનીની જેમ બીમાર થએ શકે છે.
- ⇒ મગજમાં વિવધ ન્યુરોટ્રાન્સમિટર્સ રસાયણો વ્યક્તિત્વા વિચાર, લાગણી અને વર્તન પર નિયમન કરે છે. આવા રસાયણોની ઉણપ કે ઘટાડાથી ઉદાસી રોગ થાય છે.
- ⇒ ઉદાસી રોગ થવામાં સિરોટોનીન, નોર ઓપીનેફ્રીન જેવા ન્યુરોટ્રાન્સમિટર્સ રસાયણોની ઉણપ કે ઘટાડો મુખ્ય પરિબળ છે.

(૨) ઉદાસી રોગ ધરાવતા બધા લોકો ઉદાસીન લાગે છે.

- ⇒ ઉદાસીનતા કે હતાશા એ ઉદાસી રોગોનું એક લક્ષણ છે.
- ⇒ કેટલાક વ્યક્તિત્વોમાં ગુર્સ્સો, કોઘ, ચિંતા, ડર કે લેચેની જેવા લક્ષણો પણ હોએ શકે છે.

⇒ ઘણા લોકો સંકોચથી તેમની લાગણીઓ છુપાવે છે અને તેમના દર્દ ઉપર ખોટું હાસ્ય રાખે છે.

(3) ઉદાસી રોગ ધરાવતા લોકો કમજોર હોય છે.

⇒ વ્યક્તિના ગુણા કે ધરણાશક્તિ જેમકે કમજોરી કે ગુરુસાને ઉદાસી રોગ સાથે કોઇ લેવાદેવા નથી.

⇒ હૃદયરોગ કે ડાયાબીટીસની જેમ ઉદાસી રોગ એક બીમારી છે અને તેને અટકાવવા મનોચિકિત્સકની સારવાર જરૂરી છે.

⇒ વ્યક્તિને કમજોરી કે કાયરતાની ટીકા કે મેણા ટોણા માર્યા વગર તેની થોડ્ય સારવાર કરાવો તેને મદદરૂપ થાઓ.

(4) ઉદાસી રોગની વ્યક્તિ ખૂબ રડયા કરે છે.

⇒ ઉદાસી રોગ ધરાવતી દરેક વ્યક્તિ રડ રડ કરતી નથી.

⇒ કેટલાક લોકોમાં ગુરુસો, કોઇ, ચિંતા, રડ કે બેચેની જેવા લક્ષણો પણ હોઇ શકે છે.

⇒ કેટલાક લોકો ભાવનાત્મક રીતે ખાલીપો અનુભૂવે છે અને પોતે નકામા હોવાની લાગણી અનુભૂવે છે.

⇒ ઉદાસી રોગના લક્ષણો દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. પરંતુ અન્ય બીમારીઓની જેમ જ તેને પણ સાચી મદદ અને સમર્થન વડે સારવારથી મુટાડી શકાય છે.

(5) વ્યક્તિ સાથે કશું ખરાબ થયું હોય તેને ઉદાસી રોગ થાય છે.

⇒ ઉદાસી રોગ કોઇ પણ સમયે અને વ્યક્તિનું જીવન સારી રીતે ચાલતું હોય તેને પણ થઈ શકે છે.

⇒ તાણાયુક્ત પરિસ્થિતિઓમાં ઉદાસીનતા રોગના લક્ષણોની વધુઘટ થઈ શકે છે.

(6) ઉદાસી રોગ શરમજનક બીમારી છે અને તેની અન્યો સાથે તે વિશે

ચર્ચા ન કરવી જોઈએ.

⇒ હૃદયરોગ કે ડાયાબીટીસ જેવી અન્ય બીમારી ધરાવતા લોકોને તેમની બીમારી વિશે શરમ નથી આવતી તે જ રીતે ઉદાસી રોગમાં પણ શરમ કે પસ્તાવો કરવાની કોઇ જ જરૂર નથી.

- ⇒ ઉદાસી રોગ પણ એક સામાન્ય બીમારી છે. આ રોગના લક્ષણોની ખૂલીને વાત કરાય તો વધુ સારી રીતે લક્ષણો જાણી ચોગ્ય સારવાર કરી શકાય.
 - ⇒ શરમ કે પસ્તાવો કર્યા વગર તમારી બીમારીને સ્વીકારો અને ચોગ્ય સારવાર કરાવો.
- (૭) ઉદાસી રોગ વાસ્તવમાં ગંભીર બીમારી નથી એટલે તેની સારવાર કરાવવાની કોઇ જ જરૂર નથી.
- ⇒ ઉદાસી રોગની સમયસર ચોગ્ય સારવાર કરાવવામાં ન આવે તો તે જીવલેણ નીવડી શકે છે.
 - ⇒ નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે ૭૦% આત્મહત્યાની ઘટનાઓ ઉદાસી રોગની સમયસર ચોગ્ય સારવાર ન કરાવાયી થતી હોય છે.
 - ⇒ પુખ્ખવચની વ્યક્તિમાં ઉદાસી રોગની સમયસર ચોગ્ય સારવાર કરાવવામાં ન આવે તો બેરોજગારી, આર્થિક સમસ્યા, છૂટાછેડા અથવા કેફી પદાર્થના વ્યસનમાં પરિણામે છે.
- (૮) ઉદાસી રોગ એ ટોંગ છે અને વ્યક્તિ જાતે કરીને નાટક કરે છે.
- ⇒ ઉદાસી રોગએ નાટકિય બીમારી કે ટોંગ નથી.
 - ⇒ ઉદાસી રોગ એક માનસિક બીમારી છે જે મગાજના ન્યુરોટ્રાન્સમિટર્સ રસાયણોની ઉણાપ કે ઘટાડાયી થાય છે. ઉદાસી રોગ થવામાં સિરોટોલીન, એપીનેફીન, નોર એપીનેફીન ન્યુરોટ્રાન્સમિટર્સ રસાયણોની ઉણાપ કે ઘટાડો મુખ્ય પરિબળ છે.
- (૯) ઉદાસી રોગ પુર્વજન્મના અભિશાપ કે શ્રાપ ને લીધે, ભૂત, ચૂડેલ, ડાકણા, ઝાન, વળગાડ કે કુંડાળામાં પગ મુક્કવાયી કે દુશ્મને કંદક ખવડાવવાયી કે મૂઠ મારવાયી થાય છે.
- ⇒ માનસિક બીમારી માટે આ બધી અંધશ્રદ્ધાઓ અને ઉપજાઈ કાટેલી લોક વાયકાઓ છે.
 - ⇒ મગાજમાં વિવિધ ન્યુરોટ્રાન્સમિટર્સ રસાયણો વ્યક્તિના વિગ્રાર, લાગણી અને વર્તન પર નિયમન કરે છે. આવા રસાયણોની ઉણાપ કે ઘટાડાયી ઉદાસી રોગ થાય છે.
 - ⇒ ઉદાસી રોગ થવામાં સિરોટોનીન, નોર એપીનેફીન ન્યુરોટ્રાન્સમિટર્સ રસાયણોની ઉણાપ કે ઘટાડો મુખ્ય પરિબળ છે.

- ⇒ ઉદાસીરોગ અને અન્ય માનસિક રોગો વિષે આપણા સમાજમાં વિવિધ અંદશ્રદ્ધાઓ અને ઉપજાદ કાટેલી લોક વાયકાઓથી લોકો માનસિક રોગની દવા કરતા અચકાય છે.
- ⇒ આવી અંદશ્રદ્ધાઓ અને ઉપજાદ કાટેલી વાતોથી સારો એવો ખર્ચ અને સમય વેડફાય છે અને યોગ્ય સમયે દવા ન થતાં રોગ વધુ વકરે છે મંતરેલા દોરા ધાગા તાવીજ, બાધાઓ કે વિધિઓમાં સમય બગાડયા કરતા વહેલી તક યોગ્ય મનોચિકિત્સકની સારવાર લેવી હિતાવહ છે.

(૧૦) ઉદાસી રોગની દવાઓથી વ્યસન થાય છે એ લાંબા ગાળે યકૃત કે કીડનીને નુકશાન થાય છે.

- ⇒ કોઇ પણ એલોપેથીક દવાની નાની મોટી આડઅસરો શરીર પર થતી હોય છે પરંતુ કોઇ જુવલેણ આડઅસર થવી એ ખોટી ઉપજાદ કાટેલી વાતો છે.
- ⇒ કોઇ પણ રોગની કોઇ પણ દવા આપણા દેશમાં મળતા પહેલા તેના ઉપર વિવિધ ફેઝ-I, ફેઝ-II, ફેઝ-III, ફેઝ-IV અને રેગ્યુલેટરી રીસર્ચ પરિક્ષણ થયા પછી તેના પરિણામ ભારત સરકારની ડી.સી.જી.આઈ. સંસ્થા ચકાસે છે અને જો દવાના પરિણામ સકારાત્મક હોય તો જ તેને મંજૂરી મળી શકે છે.
- ⇒ યકૃત, કીડની કે શરીરના કોઇ પણ અવયવન નુકશાન થાય તેવી દવાઓને ભારત સરકારની ડી.સી.જી.આઈ.સંસ્થા મંજૂરી આપતી નથી.
- ⇒ ઉદાસી રોગની દવાઓ મનોચિકિત્સકની જાણ બહાર જતે જ લેવામાં આવે તો શરીરને નુકશાન થઇ શકે છે.

(૧૧) ઉદાસી રોગની સારવાર શક્ય નથી.

- ⇒ ઉદાસી રોગની સમયંસરની યોગ્ય સારવારથી ૬૦% કિસ્સામાં અસરકારક ઉપયાર કરી બિમારી મટાડી શકાય છે.
- ⇒ ઉદાસી રોગના મટવાનો આધાર નિયમિત સારવાર ઉપર રહેલો છે.
- ⇒ આજના ચુગમાં ઉદાસી રોગ માટે વિવિધ દવાઓ અને અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ છે જેથી રોગ ઝડપથી કાલુમાં લાવી મટાડી શકાય છે.

→ માનસિક સ્વાસ્થ્ય જાળવવા શુ કરવું

- દરરોજ નિયમીત ચાલવુ, દોડવુ, એરોબિક્સ જેવી કસરત કરો.
- દરરોજ નિયમીત યોગ, ધ્યાન કે મેડીટેશન કરો.
- નિયમીત સમયસર પોષિક આહાર જમવાનું રાખો.
- જમવામાં લીલા શાકભાજુ અને ફળોનું સેવન નિયમીત કરો.
- આખા દિવસ દરમિયાન નિયમીત બે થી પાંચ લિટર પાણી પીવાનું રાખો.
- નિયમીત સાત થી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ.
- કોઇ પણ પરિસ્થીતીમાં ગુસ્સા ઉપર કાબુ રાખવો.
- પોતાના વ્યસ્ત જીવનમાંથી કુટુંબ, બાળકો, વડીલો અને મિત્રો સાથે સમય પસાર કરો. એકલવાચુ જીવન જીવવાનું ટાળો.
- દરરોજ પંદર થી ત્રીસ મિનિટ માટે શાંતિથી એકલા સમય પસાર કરો અને મનોમંથન કરો.
- પોતાની મુંગુપણો, સમર્થ્યાઓ, તકલીફો મનમાં ન રાખો તમારા યોગ્ય નજુકના સ્વજન કે મિત્ર જોડે સલાહ, સુચન અને માર્ગદર્શન મેળવો.
- ટેલીવિઝન, મોબાઇલ, વિડિયો ગેમ, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ યોગ્ય સમય મર્યાદામાં કરો.
- વ્યસ્ત જીવનમાંથી અછવાડીયામાં એક દિવસ વાંચન, રમત, ફરવાનો શોખ કેળવો.
- બીજાઓ સાથે નાહકની તુલનાઓ કે ગાજા બહારની હરીફાદ ટાળો, ખોટી દેખાદેખી ટાળો.
- તમાકુ, સિગારેટ, બીડી, દાઢ, ડ્રાઇન સુગાર, ગાંજા જેવા વ્યસનથી દુર રહો.
- ઉકારાત્મક અભિગામથી જીવન પસાર કરો, નકારાત્મક વિચારોને દુર કરો.

માનસિક રોગો અને લક્ષણો.

૧) વિચારવાયુ: મગાજની અસ્થિરતા, પાગલપણું

(Schizophrenia)

- આ ગંભીર પ્રકારના રોગોમાં જુદી જુદી વ્યક્તિઓમાં લક્ષણો જુદા જુદા હોય છે અને વખતો વખત બદલાતા રહે છે. દર્દીનું વર્તન, વાણી, વિચાર અને લાગણી બદલાય છે, વિચિત્ર થદ જાય છે. પોતાની તથા કુદુંબની એ સંભાળ લેતો નથી. દર્દી વિચિત્ર, ૭૫ માન્યતાઓ ધરાવે છે. લોકો મારી વિરુદ્ધ થદ ગયા છે, મારી વિરુદ્ધ કાવતરા કરે છે. દર્દી વહેમ, શંકાશીલ બને છે. એકલો ગુમસુમ રહે છે. બીજાઓને ન સંભળાય તેવા અવાજો તેને સંભળાડું. કયારેક આપદાત કે હિંસક વર્તન કરે છે.

૨) ઉદાસી રોગ (Depression)

- કશુંક માંદુ થાય તો ઉદાસ થવું સામાન્ય છે. પરંતુ તેના કારણો કામ દંધો અને સામાજુક જવાબદારી સંભાળવામાં મુશ્કેલી થાય તો તે રોગનું સ્વરૂપ ધારણ કરે છે. આ રોગમાં દર્દીને ઊંઘ બરાબર આવતી નથી, ભૂખ બરાબર લાગતી નથી, મન ઉદાસ તથા નેચેન થદ જાય છે, ઉત્સાહ, આનંદ ઉડી જાય, રડવું આવે, મરી જવાના વિચારો આવે તથા આપદાતની કોશીષ કરે.

૩) ઉંમાદ (Mania)

- આ રોગમાં દર્દીને કારણ વગાર અતિશાય આનંદ અથવા ગુલ્સો થાય છે. વધારે પડતું બોલ બોલ કરવું જેમાં પોતે ધન, શક્તિ, બુધ્યી વગોરેના સર્વશ્રોષ ન હોવા છતાં હોવાનો દાવો કરે છે. વાતચીતના મુદ્દા ફટાફટ આજુબાજુ જે વસ્તુ ચા વ્યક્તિ દેખાય તે પ્રમાણે બઢલે છે. જાતિય સંચયમ ગુમાવે, ઓછું ઊંઘવા છતાં થાક મહેસુસ ન કરે, સ્કૂર્ન અનુભવે, ફરફર કરે.

૪) ચિંતા રોગ (Anxiety Disorder)

- પરિસ્થિતિ પ્રમાણે ચિંતા થવી સામાન્ય છે, પણ જો અતિશાય ચિંતા થાય જેને કારણે દર્દીની દૈનિક, દંધાકીય પ્રવૃત્તિ પર અસર થાય અથવા

તો કારણના પ્રમાણમાં વધુ પડતી ચિંતા થાય ત્યારે તે રોગ બને છે.
આ રોગમાં દર્દીને ગભરામણા, છાતીમાં ઘબકારા વધી જવા, છાતીમાં
દુખાવો, ગળામાં ડચુરો, કંપારી, પરસેવો છૂટી જવો, ચેન ન પડવું,
એકના એક વિચારો આવવા, હાથ પગ જુઠા પડવા, હાથ પગમાં
જણાજણાટી થવી વગેરે લક્ષણો થાય છે.

૫) તીવ્ર ચિંતા રોગ (Panic Attack) :-

- અતિશાય ગભરામણા, ઘબકારા વધવા, શ્વાસ લેવામાં તકલીફ પડવી,
ધૂજારી, પરસેવો, ચક્કર આવવા, થોડા સમય માટે કંઈક થઇ જશે -
હાર્ટએટેક આવશે, હેમરેજ થઇ જશે અથવા જુય નીકળી જવાનો કે
મરી જવાનો ભય લાગવો સતત તકલીફના વિચાર આવવા, મેડિકલ
રીપોર્ટ નોર્મલ આવે છતાં વારંવાર રીપોર્ટ કરાવવાની દર્શાઓ થવી.
એકલા બહાર જતાં ડર લાગવો, કોઇના મોતના સમાચાર સાંભળી
ડરી જવું.

૬) અનિચ્છિનીય કિયા દબાણ (OCD) :-

- જેમાં વારંવાર એકના એક વિચારો અથવા એક જ કિયાનું દર્શા
વિરુદ્ધ પુનરાવર્તન જેમ કે વારંવાર હાથ ધોવા, વારંવાર ગાંધાતરી
કરવી થઇ ગયેલી કિયા બરાબર થઇ કે નહીં તે ચકાસવું તેમ કરતાં
અટકાવવામાં આવે તો ચિંતા રોગના લક્ષણો થાય છે.

૭) હિસ્ટેરીયા (Hysterical Conversion Reaction) :-

- માતા આવવી, તાણ આવવી, દાંત બંધાદ જવા, અચાનક વાચા
હરાદ જવી કે લક્ષ્ય લાગુ પડવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે મુખ્ય
લક્ષણો છે. જુદા જુદા સમયે રોગના લક્ષણો બદલાતા રહે છે.
પોતાની માનસિક પીડા તરફ લોકોનું દ્વારા ખેંચવા, સહાનુંભૂતિ
મેળવવા કે ન ગમતી જવાબદારીથી છુટકારો પામવા દર્દીને હિસ્ટેરીયા
થઇ જાય છે. ખાસ કરીને યુવાન, પરિપક્વ, નાની નાની ભાબતો
માટે બીજાઓ પર આધાર રાખતા કે બીજાના અભિપ્રાય થી જલ્દી
દોરવાદ જાય તેવી નાટકીય સ્ત્રીઓ કે કંન્યાઓમાં તણાવ જનક
પરિસ્થિતિઓમાં હિસ્ટેરીયા થાય છે.

ઘણીવાર દર્દીની જરૂરીયાતો સંતોષવા કે નાટકીય સંજોગોમાં રોગો એની મેળે મટી જાય છે. આપણે ત્યાં હિસ્ટેરીયા ને “વળગાડ” કે “માતા” રૂપે જોવા મળે છે. નવરાત્રી જેવા ધાર્મિક ઉત્સવો વખતે કે ચિંતાજનક પરિસ્થિતિમાં દર્દી ધુણે છે પોતે કોઇ દેવ દેવી કે પ્રેતાત્મા છે એવો દાવો કરે છે, એવી રીતે વર્તે છે, ભવિષ્યવાણીઓ કરે છે. બલીદાન માગો છે. દર્દીના રોગોના લક્ષણો પર ધ્યાન આપવું નકામું છે. તેમ કરતાં તેની તકલીફ વધતીજ જાય છે. દર્દ ઉપકે ત્યારે ખરેખર તો મનોવિશ્લેષણ દ્વારા તેના મનની શી ચિંતાઓ છે તે જાણી તે અંગો યોગ્ય સારવાર કરવામાં આવે તો હિસ્ટેરીયાના લક્ષણો દૂર થઈ શકે.

૬) Somatoform Disorder / Hypochondriasis :-

- શરીરમાં એક સાથે જુદી જુદી જગ્યાએ તકલીફ થવી.
દા.ત. ઊંઘો ગેસ ચટવો, માથું દુઃખવું, પેટમાં દુઃખવું, થાક લાગવો,
છાતીમાં દુઃખાવો થવો.
- તકલીફના મેડીકલ રિપોર્ટ નોર્મલ આવવા.
- સતત મોટી બીમારી હોવાનો ભય રહેવો.
દા.ત. હાર્ટ એટેક, કેન્સર, એઝડસ, હેમરેજ વગેરે.

૭) વ્યસનો બંધાણને લગતા રોગો (Addictions) :-

- દારુ, મધ્યપાન, સ્પીરીટ, અફ્ઝિન, ચરસ, ભાઉન સુગર,
ગાર્ડ, કેક, ચરસ, ભાંગ, ગાંઝો, હેરોઇન, તમાકુ, ચા-કોફીનું વ્યસન,
ટ્રામાડોલ, ડોલોપેક્શ, ગાર્ડિનલ, મેન્ડ્રેક, ડાયાફેપામ, પેથીડીન, ફોર્ટલીન
ઇંજેક્શનોના વ્યસનો.

૧૦) મનોજાતીય રોગ (Psychosexual Disorders) :-

- સ્વાન દોષ, હુસ્તમૈથુન, ઇન્ન્દ્રીયની શિથિલતા, નપુંસકતા, પેશાલમાં
ઘાતુ જરવી, જાતીય દરઢાઓ અભાવ, શીધ્યપતન, સજાતિયવૃત્તિ
વગેરે મુખ્ય તકલીફો જોવા મળે છે.

૧૧) માથાનો દુખાવો તથા આધારીશી

(Headache; Migraine) :-

- માથું ભારે લાગવું, બળતરા થવી, ખીંચ અને જાટકા આવવા,
માથાની નસો કુલી જવી, બેભાન થઈ જવું, અડધું માથું દુખવું.

૧૨) ઊંઘને લગતા રોગો (Sleep Disorders) :-

- અનીક્રિયા તથા વધારે પડતી ઊંઘ, ઊંઘમાં બોલવું, ઊંઘમાં ચાલવું વગેરે

૧૩) વાઇ, ખેંચ, તાણા (Epilepsy) :-

- જેમાં દર્દીને બે-પાંચ મિનિટ ખેંચ આવે છે જે દરમિયાન દર્દી બેહોશ થઈ જાય, કચારેક જુલ કચડાઈ જાય તથા કપડામાં પેશાબ અથવા સંડાસ થઈ જાય અને દર્દીને ખેંચ બાબતે કશી ખબર ન હોય ખેંચ ગમે ત્યાં અને ગમે ત્યારે થાય છે.

૧૪) બાળકોના માનસિક રોગો

(Child Psychiatric Disorders) :-

- મગજ ચાલતું નથી મંદ બુદ્ધિ અથવા બુદ્ધિનો ઓળો વિકાસ, મંદ બુદ્ધિને કારણે ઉત્પણ્ણ થતી સમસ્યાઓ બેદ્યાનપણું નિર્જીવતા
- વાંચવા, લખવા, બોલવા તથા ગણિત ગણવાની ગંભીર તકલીફો ખાવા માટેની જીદ, માટી ખાવી, અતિ ખાઉધરા હોવું, શરીર ગળવું, અમુક વસ્તુઓ ખાવાનો હઠાગ્રહ.
- બાલ્યવર્ષથા જન્ય અતિશાય ચિંતા, ડર, છિંન મનોવિકૃતિઓ
- તોતકું બોલવું, ચુપ-શરમાળપણું
- નખ કરડવા, અંગુઠો ચુસવો
- નિશાળે જતાં ડર લાગવો
- માથા પછાડવા, અતિશાય તોઝાન
- ભણવામાં પાછા પડવું
- પથારી ભીજવવી, પથારીમાં ઝાડા કરવા.
- રાગ્રિ દરમિયાન ચાલવું, ચીસો પાડવી, બોલવું
- શરીરના અંગો હલાવવા, શરીર હલાવવું.

૧૫) મનોએટિક રોગો (Psychosomatic Disorder) :-

જેમાં સ્થૂળતા, એસીડીટી, અલ્સર, દમ વગેરે મુખ્ય છે. જે વ્યક્તિને માનસિક પુષ્ટા મેળવવામાં રહેલી ખામીને કારણે વ્યક્તિ તણાવને ચોગ્ય રીતે સહી શકતો નથી અને આવી બીમારીઓનો ભોગ જને છે.

● તાત્કાલિક સારવાર માગતી માનસિક બીમારીઓ :-

- 1) આપદ્ધાતનો પ્રયાસ અથવા સતત વિચારો.
- 2) લિંસક અતિશાય ગુલ્સો, ઉશ્કેરાટ, તોડફોડ, ખૂની મનોવૃત્તિ.
- 3) સનેપાત, ચિત્તભ્રમ
- 4) અતિશાય શોક, ગંભીર આધાત

● સારવાર પદ્ધતિઓ :-

- 1) આધુનિક દવાઓ (Drug Therapy)
- 2) આધુનિક વિજળીક સારવાર (ECT)
- 3) વિવિધ મનોપચાર (Psychotherapy)

સાનિદ્ય માનસિક અને મગજના રોગોની હોસ્પિટલ

◆ ઉપલબ્ધ સારવાર સુવિધાઓ :

● માનસિક રોગો :

ઉદાસીનતા, હતાશા, નિરાશા (ડિપ્રેશન), તણાવ, ચિંતા, ફડકી, તીવ્ર ઉશ્કેરાટ, કોઇ, અકારણ ગુલ્સો, ઉન્માદ, એકજ પિચાર કે કિયાનું પુનરાવર્તન (ઓ.સી.ડી.), અનિદ્રા, અતિશોક વિલાપ, શંકા, વહેમ, ડર, જીક, વિચારવાચ્યું (સ્કીગોફેનિઆ), હિસ્ટેરીયા, આપઘાતના વિચારો, પાગલપન, વળગાડ કે બકવાસ કરવો જેવા માનસિક રોગોની સચોટ સારવાર.

● મગજના રોગો :

ચક્કર આવવા, ભુલવાની બિમારી, ઝૂટિભ્રંશ (ડિમેન્શિઓ), કંપવાત (પાર્કિન્સોનિગ્રમ), ધૂજરી, જ્ઞાનતંતુ અને મગજની નશોની તકલીફો, શરીરના હલન ચલન ને લગતા રોગોની સલાહ સારવાર.

● હેડેક કિલનીક :

માથાનો દુખાવો, શરદ્દ, આધારીશી માઈગ્રેન, વાસ્ક્યુલર હેડેક, ટેન્શન હેડેક, કલસ્ટર હેડેક, માથાની બળતરા, લાંબા સમયનો માથાનો દુખાવો, મગજ અને માથાના વિવિધ પ્રકારના દુખાવા, ગરદન અને મોટાના દુખાવા, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિઓ ની સારવાર.

● એપિલેપ્સી કિલનીક :

વાઈ, ખેંચ, તાણા, એપિલેપ્સી નું સચોટ નિદાન, સલાહ સારવાર.

● વ્યાસનમુક્તિ કેન્દ્ર :

દારુ, અફીણ, ડોડા, ભાંગ, ચરસ, ગાંભે, તમાકુ, બીડી, સિગારેટ, નશીલી ઊંઘની દવાઓ જેવા વ્યાસન માટે વ્યાસનમુક્તિ સલાહ સારવાર.

- **બાળ માનસિક રોગ સારવાર :**
મંદબુધ્ય, બેદ્યાનપણું, અનીંદ્રા, ચમકી જવું, પેશાબની તકલીફો, ચંચળતા, અતિશાય તોફાન, કોઘ, કોઇનું કહેણું ન માનવું, ભણવામાં પાછા પડવું, ચાદ ન રહવું, હતાશા, વિચારવાચું, વિશીષ શિખવાની સમર્થ્યાઓ માટે સલાહ સારવાર.
- **એકેડેમીક ગાયડન્સ કિલનીક :**
શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે કેરીથર એકેડેમીક સ્કોલેટીક ગાયડન્સ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ.
- **સાઇકોસેક્સુઅલ કિલનીક :**
સેકસ રોગો મનોજાતિય રોગો માટે સલાહ સારવાર માર્ગદર્શન.
- **કાઉન્સેલિંગ સેન્ટર :**
સાઇકોથેરેપી સીટીંગ, ગૃહ થેરેપી, ફેમીલી થેરેપી, મરાઇટલ કાઉન્સેલિંગ બીહેવીયર થેરેપી, કોગનીટીવ થેરેપી અને વિવિધ સાઇકોથેરેપી સારવાર.
- **જીરીઆટ્રીક સાઇક્યાટ્રીક કિલનીક :**
વૃદ્ધા અવસ્થાની માનસિક બીમારીઓ જેમકે ઉદાસીનતા, વિચારવાચું, અનિદ્રા સ્મૃતિભ્રંશ, ભૂલવાની જિમારી, ઉલ્માદ, બજવાસ કરવો, માથું દુખવું, ચક્કર કે ખોચ જેવા રોગાની સારવાર.
- **ફિનેન્શિયલ સાઇક્યાટ્રીક કિલનીક :**
માસિકની શરૂઆત કે મેનોપોઝ તેમજ પ્રસુતિ દરમિયાન કે પછી થતી માનસિક જિમારીઓની સારવાર જેમકે અકારણ ચીડીયાપણું, કોઇગુસ્સો, હુદ્દી વલણ કે સ્વભાવ, હતાશા, જિરાશા, ઉદાસીનતા, ચિંતા, શરીરની બળતરા કે દુખાવો, માથું દુખવું, ડર, ભય, શંકા, વહેમ, ઊંઘની અનિયમીતતા, માથું દુખવું જેવા લક્ષણોની સારવાર.
- **ઓબેસીટી કિલનીક :**
સાનિધી ફીગીયોથેરેપી એન્ડ ફીટનેસ સેન્ટરમાં અત્યાધુનિક સાધનો દ્વારા વજન ઉતારવા ફીટનેસ માટે અને સ્લીમીંગ તેમજ વેલનેસ માટે સલાહ સારવાર સુવિધા ઉપલબ્ધ છે.
- **માનસિક રોગ સલાહ સારવાર કેન્દ્ર :**
માનસિક અને મગજના રોગો વિષે મુંજવતા પ્રશ્નો માટે યોગ્ય સલાહ, માર્ગદર્શન, નિદાન અને સારવાર.

સાનિદ્ય સાઈકોથેરેપી એન્ડ કાઉન્સેલિંગ સેન્ટર પાલનપુર

ડૉ. નિશાંત એ. એની એમ.ડી. સાઈકાટ્રી - મનોધિકિલ્સક

• માનસિક અને મગજના રોગોના નિષ્ણાત
• મનોજાતિય રોગોના નિષ્ણાત (સેકસ થેરાપીસ્ટ)

• વ્યાસનમુક્તિ સારવાર ના નિષ્ણાત
• બાળ માનસિક રોગોના નિષ્ણાત

સાઈકોલોજીસ્ટ - રાજેશ ભૂતઠીયા (એમ.એ. સાઈકોલોજી, પી.જી.ડી.આર.પી.)

નીતી પરમાર (એમ. એ. સાઈકોલોજી, પી.જી.ડી.આર.પી.)

નુર મનસુરી (એમ. એ. સાઈકોલોજી)

ઉપલબ્ધ સુવિધાઓ અને સારવાર :

⇒ એક થી બાર વર્ષ

- બૃદ્ધિ આંક (Intelligence Quotient) I.Q. Testing
- રસ કસોટી (Interest)
- ગુસ્સાનું પ્રમાણ (Agression)
- શાળા અને ઘરમાં અનુકૂલન (Adjustment at Home & School)
- સામાજિક અનુકૂલન (Social Maturity)

⇒ દસ થી અઠાર વર્ષ

- એપ્ટીટ્યુડ (Aptitude)
- લાગણીશીલતા (Emotional Quotinet) E.Q.
- કારકિદી (Career Guidance)
- વ્યક્તિત્વ (Personality)
- રસ કસોટી (Interest)
- ગુસ્સો (Agresion)

⇒ અટાર વર્ષ થી ઉપર :

- વ્યક્તિત્વ વિશ્રલેખણ (Personality Analysis)
- વ્યવસાયલક્ષી માર્ગદર્શન (Vocational Guidance)
- આંતરીક સંબંધો (Interpersonal Relations)
- પ્રતિકારકતા અને અનુકૂલનની કણા (Defenses & Coping Strategies)
- આંતરીક જરૂરત, ધગશ અને અથડામણ (Inner Needs, Motives & Conflicts)

→ ન્યુરો સાઈક્યાટ્રી ઇવેલ્યુઅશન

- એમ. એમ. પી. આઈ.
- એમ. એમ. એસ. ઈ
- વિવિધ રેટિંગ સ્કેલ

→ સાઈકોથેરેપી

- ફેમીલી થેરેપી ■ કપલ થેરેપી ■ મરાઈટલ કાઉન્સેલિંગ ■ મોટીવેશન થેરેપી
- બીહેવીયર થેરેપી ■ એકેડેમીક ગાઈડન્સ ■ કેરીયર ગાઈડન્સ
- વોકેશનલ ગાઈડન્સ ■ સાઈકોસેક્સ્યુઅલ કાઉન્સેલિંગ
- પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ બોડી લેન્વેજ ■ ગૃહ થેરેપી
- સ્ટ્રેસ મેનેજમેન્ટ એન્ડ રીલેક્ષેશન થેરેપી ■ એન્ગાર થેરેપી ■ લાઇફ સ્ટાઇલ મોડિફિકેશન

સાઈકોલોજીસ્ટ :-

૧). રાજેશ ભૂતડીયા :- એમ. એ. સાઈકોલોજી, પી.જી.ડી.આર.પી.
9429193508

સાનિદ્ય માનસિક અને મગજના રોગોની હોસ્પિટલ

ડૉ. નિર્શાંત એ. સૈની

એમ.ડી. - સાઇફ્યુન્ઝિ



- માનસિક અને મગજના રોગોના નિષ્ણાત
- વ્યસનમુંજિના સારવારના નિષ્ણાત
- મનોઅભિયાન રોગોના નિષ્ણાત (સેક્ઝ થેરાપીસ્ટ)
- બાળ માનસિક રોગોના નિષ્ણાત

◆ શૈક્ષણિક લાયકાત અને કારકિર્દીની ગલક ::

- એચ.એસ.સી.ઈ. (માર્ચ - ૧૯૯૮)
શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર, પાલનપુર
- એમ.બી.બી.એસ. (ઓક્ટોબર-૨૦૦૪)
બી.એ. મેડિકલ કોલેજ, સીવીલ હોસ્પિટલ, અમદાવાદ
- એમ.ડી.સાઇફ્યુન્ઝિ (મે-૨૦૦૮)
વી.એસ. હોસ્પિટલ, એન.એચ.એલ. મેડિકલ, કોલેજ, અમદાવાદ
- શીર્ષચિહ્ન આસીસ્ટન્ટ (મે-૨૦૦૫ થી ઓગસ્ટ-૨૦૦૮)
માનસિક રોગ વિભાગ, વી.એસ. હોસ્પિટલ, અમદાવાદ
- આસીસ્ટન્ટ મનોચિકિત્સક અને શીર્ષચિહ્ન આસીસ્ટન્ટ
(મે-૨૦૦૮ થી ઓગસ્ટ-૨૦૦૮)
શ્રી કિંબ્રાન્ડ માનસિક રોગોની હોસ્પિટલ, અમદાવાદ
- મુખ્ય મનોચિકિત્સક (સપ્ટેમ્બર-૨૦૦૮ થી જુન-૨૦૦૯)
ગાંધી લિંકન હોસ્પિટલ, ભણસાલી ટ્રસ્ટ, ડીસા
- વ્યસનમુંજિ નિષ્ણાત (સપ્ટેમ્બર-૨૦૦૮ થી જુન-૨૦૦૯)
અંગ્રેન્ડ મુંજિના વિભાગ, ગાંધી લિંકન હોસ્પિટલ, ભણસાલી ટ્રસ્ટ, ડીસા
- મુખ્ય મનોચિકિત્સક (સપ્ટેમ્બર-૨૦૦૮ થી જુન-૨૦૦૯)
આર.સી. પરીખ હોસ્પિટલ, ભણસાલી ટ્રસ્ટ, થરાદ
- મુખ્ય મનોચિકિત્સક (સપ્ટેમ્બર-૨૦૦૮ થી જુન-૨૦૦૯)
સ્લી અને બાળરોગ હોસ્પિટલ, ભણસાલી ટ્રસ્ટ, ચાંદનપુર

- મુખ્ય મનોચિકિત્સક (ઓગસ્ટ-૨૦૦૮ થી ઓગસ્ટ-૨૦૧૧)

મહેતા હોસ્પિટલ, સાંચોર

- મુખ્ય મનોચિકિત્સક (ઓગસ્ટ-૨૦૦૮ થી ઓગસ્ટ-૨૦૧૦)

સમગ્રીશર હોસ્પિટલ, સુમેરપુર.

- મુખ્ય મનોચિકિત્સક (ઓગસ્ટ-૨૦૦૮ થી ઓગસ્ટ-૨૦૧૧)

શેરમહોમદ ડીસ્પેન્સરી, કાણોડર.

- મુખ્ય મનોચિકિત્સક (ઓગસ્ટ-૨૦૦૮ થી ઓગસ્ટ-૨૦૧૧)

સિવિલ હોસ્પિટલ, ગઢ-મડાણા

- મુખ્ય મનોચિકિત્સક (ઓગસ્ટ-૨૦૦૮ થી ઓગસ્ટ-૨૦૧૧)

લાયન્સ હોસ્પિટલ, પાલનપુર

◆ એવોર્ડ અને સંભાન

- નેશનલ યંગ સ્કોલર એવાર્ડની પ્રથમ સ્પદિમાં ભારતમાં બીજા સ્થાને અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું. (ફેબ્રુઆરી-૨૦૦૮)

- ગુજરાત માલી ફેડરેશન દ્વારા ગુજરાતના માલી સમાજના પ્રથમ એકમાત્ર મનોચિકિત્સક માટે વિશિષ્ટ ગૌરવ સંભાન મેળવ્યું. (ફેબ્રુઆરી-૨૦૦૬)

- સૈની ક્ષત્રિય (માલી) પંચાયત દ્વારા ગુજરાતના માલી સમાજના પ્રથમ એકમાત્ર મનોચિકિત્સક માટે વિશિષ્ટ મહાનુભાવ સંભાન મેળવ્યું.
(૨૦૦૮)

- ગુજરાત માલી ફેડરેશન અને મહાત્મા જ્યોતિલા કુલે સેવા સંસ્થાન દ્વારા ગુજરાતના માલી સમાજના પ્રથમ એકમાત્ર મનોચિકિત્સક માટે વિશિષ્ટ પારિતોષિક સંભાન મેળવ્યું. (ફેબ્રુઆરી-૨૦૧૧)

◆ રીસર્ચ ::

- ગુજરાત ચુનિવર્સિટી અમદાવાદમાં ઉદાસી રોગ અને દ્રીધૃવી ઉદાસી રોગનો અભ્યાસ કરી રિસર્ચ ક્ષેત્રે શરૂઆત કરી.

- ઉદાસી રોગથી પીડીત ગર્ભવતી રતી અને ગર્ભસ્થ શીશુ ઉપર દવાઓની અસરો વિશે પેપર નેશનલ યંગ સ્કોલર સ્પદિમાં રજુ કર્યું.

◆ ટ્રેઇનીંગ :

- વુડાફિજ મેન્ટલ હોસ્પિટલ સિંગાપોરમાં ઇન્ડો સિંગાપોર પી.જી.ડેવલપમેન્ટ પ્રોગામની તાલીમ મેળવી (જુન-૨૦૦૬)
- ગુડ કલીનીકલ પ્રેક્ટીસ આધ.સી.એચ.જી.સી.પી. કોર્સની તાલીમ કવીન્ટાઇલ્સ ઇન્ડીયા લીમીટેડ, લુન્ડબેક ઇન્ડીયા લીમીટેડ, ફાઇન્ફાન્ડ ઇન્ડીયા લીમીટેડ, ગ્લેક્સો સ્મીથ કલાઇન લીમીટેડ, પ્રિસ્ટલ મેયર સ્ક્રિબ, સીરો ઇન્ડીયા લીમીટેડ, આઇકોન કલિનિકલ રીસર્ચ અને જેન્સન જેવી ખ્યાતનામ કંપનીઓ પાસેથી મેળવી.
- માનસિક રોગોના રીસર્ચના રેટીંગ સ્કેલની તાલીમ ફાર્મા સ્ટાર, ગ્લોબલ લર્નિંગ, યુનાઇટેડ બાયોસોર્સ, બાયોનીય, મેડીકેટા અને ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી મેળવી છે.
- ઉંમાદ રોગના રીસર્ચની તાલીમ બાસીલોના, સ્પેન યુરોપમાં ફાઇન્ફાન્ડ કંપની દ્વારા મેળવી (માર્ચ-૨૦૦૬)
- ઉંમાદ રોગના રીસર્ચની તાલીમ ગોવામા પ્રિસ્ટલ મેયર સ્ક્રિબ અને સીરો ઇન્ડીયા કંપની દ્વારા મેળવી (માર્ચ-૨૦૦૬)
- વિચારવાયુ સ્ક્રિપ્ટોફેનીઆ રોગના રીસર્ચની તાલીમ સીંગાપોરમાં જેન્સન એન્ડ જેન્સન કંપની દ્વારા મેળવી (ઓક્ટોબર-૨૦૦૬)
- ઉદાસી ડિપ્રેશન રોગના રીસર્ચની તાલીમ મલેશીયામાં લુન્ડબેક કંપની દ્વારા મેળવી (ફેબ્રુઆરી-૨૦૦૮)
- વિચારવાયુ સ્ક્રિપ્ટોફેનીયા રોગના રીસર્ચની તાલીમ મલેશીયામાં લુન્ડબેક કંપની દ્વારા મેળવી. (મે-૨૦૦૮)
- સૃતિભ્રંશ (ડિમેન્શીયા) રોગના રીસર્ચની તાલીમ થાઇલેન્ડમાં લુન્ડબેક કંપની દ્વારા મેળવી. (ઓક્ટોબર-૨૦૦૮)
- એમ.ડી. સાઇકાટ્રીની તાલીમ દરમિયાન વિવિધ ફેઝ-I, ફેઝ-II, ફેઝ-III, ફેઝ-IV અને રેગ્યુલેટરી રીસર્ચમાં પણ સબઇન્વેસ્ટીગેટર અને મુખ્યરેટર તરીકે રહેલ છે.

સાનિધ્ય માનસિક રોગોની હોસ્પિટલ
સાનિધ્ય વ્યસન મુક્તિ કેન્દ્ર
સાનિધ્ય સાઈકોથેરાપી સેન્ટર
સાનિધી ફીડીયોથેરાપી અને ફીટનેસ સેન્ટર

ડૉ. નિશાંત એ. સૈની

એમ.ડી. સાઈકથાટ્રી

ફોન: (૦૨૭૪૨) ૨૫૭૬૬૬
 મો. ૮૪૨૬૬ ૨૨૦૬૬
 મો. ૮૩૭૬૨ ૧૪૧૧૧
 મો. ૮૪૨૮૫ ૧૭૬૬૬

ડૉ. પ્રિયંકા એન. સૈની

બી.પી.ટી.એમ.આઈ.એ.પી.

મો. ૮૪૨૬૬ ૨૨૦૭૭

સાઈકોલોજીસ્ટ

રાજેશ ભુતડીયા

એમ.એ. સાઈકોલોજી, પી.જી.ડી.આર.પી.

મો. ૮૪૨૬૧ ૯૩૫૦૮

-: મેનેજુંગ ડીરેક્ટર :-

કમલેશભાઈ પટેલ મો. ૮૪૨૮૫ ૫૮૬૭૮

-: હોસ્પિટલ હેલ્પલાઇન :-

જયેશભાઈ સોલંકી મો. ૯૯૭૪૧ ૦૨૩૬૭

આધુનિક યુગમાં માનસિક સ્વાસ્થ્ય શારીરીક સ્વાસ્થ્ય કરતા વધુ મહત્વનું છે.

આજના આધુનિક યુગમાં ઉદાસી રોગની સારવાર શક્ય છે.

ઉદાસી રોગ મેલી શક્તિઓ, વળગાડ કે પ્રકોપ થી થતો રોગ નથી. આ મગજનો એક પ્રકારનો રોગ છે.

ઉદાસી રોગથી ડર્યા કે શરમાયા કે પસ્તાવો કર્યા વગર તેનો સ્લિકાર કરો, સામનો કરો અને દવા નિયમિત લો અને સકારતમક જીવન જીવો.

સાઈકોથેરેપી અને કાઉન્સેલિંગ એક પ્રકારની મનોવૈજ્ઞાનિક સારવાર છે.

ઉદાસી રોગના દર્દીના માનસિક, આર્થિક સામાજિક અને કૌટુંબિક હિતોનું રક્ષણ કરવાની જવાબદારી આપણા સૌની છે.

ઉદાસી રોગને સમજીએ અને તેની યોગ્ય સારવાર કરવાનો પ્રયાસ આજથી કરીએ.

સાનિધ્ય માનસિક રોગોની હોસ્પિટલ
સાનિધ્ય વ્યસનમુક્તિ કેન્દ્ર,
સાઈકોથેરેપી અને કાઉન્સેલિંગ સેન્ટર

બીજો માળ, સાંચ કોમ્પ્લેક્સ, ગોબરી રોડ, ગાઠમણ ગેટ - 385001

સમય : સવારે 9-00 થી 2-30 સાંજે 5-30 થી 7-30 (સોમવાર થી શનિવાર)

ડૉ. નિશાંત એ. સૈની એમ.ડી. (સાઈક્યાટ્રી)

-: સાઈકોલોજિસ્ટ :- રાજેશ ભૂતિયા : 9429193508

ફોન : 02742-257666 મો :: 9429922066

મો : 9376214111

BATTLE FOR THE HEALTHY MIND